



બ્રેમ્પટન એન્ટરપ્રિન્યુર સેન્ટર એપ્રિલ 12 નાં રોજ ગ્રાહકો માટે ફરીથી ખુલશે

બ્રેમ્પટન, ઓન્ટેરિયો (એપ્રિલ 8, 2022) – આરોગ્ય અને સુરક્ષા પર સતત ધ્યાન આપીને, બ્રેમ્પટન એન્ટરપ્રિન્યુર સેન્ટર (BEC) અને કો-વર્કિંગ સ્પેસ મંગળવાર, એપ્રિલ 12, 2022 થી દર મંગળવારે અને દર ગુરુવારે સવારે 9 થી બપોરે 4 વાગ્યા સુધી રૂબરૂમાં સેવાઓ માટે ફરીથી ખુલશે.

કો-વર્કિંગ સ્પેસનો ઉપયોગ કરવા અરજીઓ BEC ને રજૂ કરવી રહી અને તેઓ દ્વારા મંજૂર થવી રહી. અરજીઓ વેબસાઈટ Brampton.ca/incubator પર રજૂ કરી શકાય છે. મંજૂર થયેલા આવેદનકર્તાઓ માટે કો-વર્કિંગ સવારે 9 વાગ્યાથી બપોરે 4 વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે.

જુલાઈ 4, 2022 થી શરૂ થતા અઠવાડિયે દિવસો નિર્ધારિત કરવાને અધીન, કો-વર્કિંગ સ્પેસ અઠવાડિયે ત્રણ દિવસ ખુલ્લી રહેશે.

BEC નાં ધંધાકીય સલાહકારો સાથેની સલાહ-મસલતો આ સમયે વર્ચ્યુઅલ રહેશે અને [બુકિંગ અગાઉથી](#) કરાવવું રહ્યું. લોકર્સ ઉપલબ્ધ નથી.

સીટી સગવડોમાં પ્રવેશવા હવે ફેસ માસ્ક્સ પહેરવા જરૂરી ન હોવા છતાં, કો-વર્કિંગ સ્પેસના વપરાશકર્તાઓને તે પહેરવાનું ચાલુ રાખવાનું પસંદ કરતા લોકોનો આદર કરવાનું કહેવામાં આવે છે. વ્યક્તિઓ વચ્ચે શારીરિક અંતર જાળવવું, ક્ષમતા સીમાઓ અને પ્રી-સ્ક્રીનિંગની હવે જરૂર નથી, પણ વ્યક્તિઓએ ઘરે રહેવું જોઈએ જો તેઓને અસ્વસ્થતા લાગે.

કો-વર્કિંગ સ્પેસની પહોંચ ધરાવતી કોઈપણ વ્યક્તિએ પોતાના વર્કસ્પેસનો ઉપયોગ કરતા પહેલાં અને પછી, તેમજ જગ્યા (ફોન બુથસ /મીટિંગ રૂમ્સ)માંની કોઈપણ અસ્ક્યામતોનો ઉપયોગ કરતા પહેલાં અને પછી તે જગ્યાને સેનિટાઈઝ કરવી જરૂરી બનશે. સેનિટાઈઝેશન વાઈપ્સ ઉપયોગ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે.

બ્રેમ્પટન એન્ટરપ્રિન્યુર સેન્ટર પર વધુ માહિતી માટે વેબસાઈટ Brampton.ca/bec જુઓ.

-30-

મીડિયા સંપર્ક (MEDIA CONTACT)

સીટી ઓફ બ્રેમ્પટન મલ્ટીકલ્ચરલ મીડિયા

multiculturalmedia@brampton.ca